

જનસંપર્ક અધીકારી દ્વારા

પોલીસ કમિશનરશ્રીની કચેરી, અમદાવાદ શહેર

ટેલીફોન નંબર ૨૫૬૩૩૩૩૩

કંટ્રોલરૂમ ટેલી.નં. ૨૫૬૩૦૧૦૦, ૨૫૬૩૦૨૦૦, ૨૫૬૩૦૪૦૦ ફેક્સ: ૨૫૬૩૦૬૦૦

તા.૧૨/૦૮/૨૦૧૮ બુધવાર

અમદાવાદ શહેર પોલીસ સમાચાર

અમદાવાદ શહેર પોલીસ તરફથી કરવામાં

આવેલ પ્રશંસનીય/નોંધપાત્ર કામગીરી :-

સમાચાર યાદી નં.૧૭૭૩/૧૮

અમદાવાદ શહેર વિસ્તારમાં ચેઈન સ્નેચીંગ તથા લુંટ કરનાર ગેંગના એક સાગરિતને લુંટના મુદ્દામાલ સાથે પકડી પાડતી અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાંચ.

અમદાવાદ શહેર વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી એકલ દોકલ મહિલાઓ તેમજ અન્ય લોકોના ગળામાંથી સોનાની ચેઈન, મંગળસુત્ર વિગેરેની લુંટ થવાના બનાવોનો ઉપદ્રવ વધી ગયેલ હોય આવા પ્રકારના ગુનાઓનો ભેદ ઉકેલવા સારૂ શ્રી જી.કે.ભટ્ટ ખાસ પોલીસ કમિશ્નર ક્રાઇમ બ્રાંચ નાઓએ સુચના આપેલ હોય જે સુચના આધારે શ્રી દીપન ભદ્રન નાયબ પોલીસ કમિશ્નર ક્રાઇમ બ્રાંચ તથા શ્રી એસ.એલ. ચૌધરી ઈન્ચાર્જ મદદનીશ પોલીસ કમિશ્નર ક્રાઇમ બ્રાંચ અમદાવાદ શહેર નાઓના માર્ગદર્શન/સુચના હેઠળ ઓટોરીક્ષા પેસેન્જર ચોરી/લુંટ અને ઝાસ બ્રેકીંગ થેફ્ટ સ્કોડના પો.ઇન્સ. શ્રી આર.એસ.સુવેરા નાઓના સ્કોડના પો.સ.ઇ શ્રી વાય.એમ.ગોહિલ, પો.સ.ઇ. શ્રી વાય.જી.ગુર્જર, પો.સ.ઇ. શ્રી આર.જી.ચૌધરી, પો.સ.ઇ. શ્રી આર.પી.ભરવાડ નાઓ સ્ટાફના માણસો સાથે પેટ્રોલીંગમાં હતા દરમ્યાન સ્ટાફના હે.કો.નારસિંહ મલુસિંહ તથા હે.કો. પ્રતાપસિંહ સુખાજી નાઓને ખાનગી રાહે મળેલ ચોક્કસ બાતમી હકીકત આધારે આરોપી વિશાલ ઉર્ફે ગોંદુ સ/ઓ પ્રકાશભાઈ કિશનચંદ ગનવાણી (સિંધી) ઉ.વ.૧૯ રહે.સી/૩, કિશન કનૈયા ફ્લેટ, કોમ્યુનીટી હોલની પાછળ, સરદારનગર, અમદાવાદ શહેર નાને પકડી પાડી તેની પાસેથી સોનાની ચેઈન કિં.રૂ.૪૧,૫૦૦/- ની મત્તાની રિકવર કરેલ છે.

પકડાયેલ આરોપીની પુછપરછ તપાસ દરમ્યાન નીચે મુજબના ગુનાઓનો ભેદ ઉકેલાયેલ છે.

(૧) નરોડા પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૧૨૫/૨૦૧૮ ઈ.પી.કો. કલમ ૩૫૬,૩૭૯,૧૧૪

(૨) સરદારનગર પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૨૫૭/૨૦૧૮ ઈ.પી.કો. કલમ ૩૮૪,૧૧૪

આરોપીનો ગુનાહિત પુર્વ ઇતિહાસ

પકડાયેલ આરોપી વિશાલ ઉર્ફે ગોંદુ અગાઉ નરોડા પોલીસ સ્ટેશનમાં મોબાઈલ લુંટના ગુનામાં પકડાયેલ છે.

અમદાવાદ શહેર તથા ગ્રામ્ય વિસ્તારોમાં ભીડભાડવાળી જગ્યાઓએ લોકોના મોબાઈલ ફોન, પર્સ વિગેરે ચીજવસ્તુઓની ઉઠાંતરી કરતી ગેંગના ત્રણ સાગરિતોને ચોરીના મોબાઈલ ફોન વિગેરે મુદ્દામાલ સાથે પકડી પાડતી અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાંચ.

અમદાવાદ શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ભીડભાડવાળી જગ્યાઓએ લોકોની ભીડનો લાભ ઉઠાવી ધક્કા મુક્કી કરી મોબાઈલ ફોન, પાકીટ વિગેરેની ચોરીઓના બનાવોનો ઉપદ્રવ વધી ગયેલ હોય આવા પ્રકારની ચોરીઓના ગુનાઓનો ભેદ ઉકેલવા સારૂ શ્રી જે.કે.ભટ્ટ ખાસ પોલીસ કમિશ્નર ક્રાઇમ બ્રાંચ નાઓએ સુચના આપેલ હોય જે સુચના આધારે શ્રી દીપન ભદ્રન નાયબ પોલીસ કમિશ્નર ક્રાઇમ બ્રાંચ તથા શ્રી એસ.એલ. ચૌધરી ઈન્ચાર્જ મદદનીશ પોલીસ કમિશ્નર ક્રાઇમ બ્રાંચ અમદાવાદ શહેર નાઓના માર્ગદર્શન/ સુચના હેઠળ ઓટોરીક્ષા પેસેન્જર ચોરી/લુંટ અને ગ્લાસ બ્રેકીંગ થેફ્ટ સ્કોડના પો.ઇન્સ. શ્રી આર.એસ.સુવેરા નાઓના સ્કોડના પો.સ.ઇ શ્રી વાચ.એમ.ગોહિલ, પો.સ.ઇ. શ્રી વાચ.જી.ગુર્જર, પો.સ.ઇ. શ્રી આર.જે.ચૌધરી, પો.સ.ઇ. શ્રી આર.પી.ભરવાડ નાઓ સ્ટાફના માણસો સાથે તા. ૧૧/૦૮/૨૦૧૮ ના રોજ પેટ્રોલીંગમાં હતા દરમ્યાન સ્ટાફના પો.કો.કૌશીક ગોવિંદભાઈ તથા પો.કો.પ્રદિપસિંહ હઠીસિંહ નાઓને ખાનગી રાહે મળેલ ચોકકસ બાતમી હકીકત આધારે આરોપીઓ (૧) ભગવતદયાલ ઉર્ફે બાબુ સ/ઓ દેવીદયાલ ખ્યાલીરામ જાતે ગૌતમ ઉ.વ.૪૩ રહે.૧૫/૪૯૫, ભવાનીનગર, ઓઢવ કેનાલ પાસે, ઓઢવ, અમદાવાદ શહેર મુ.ગામ આનેપુરા, તા.જિ.ઈંટાવા, થાના બકેવર, મધ્યપ્રદેશ (૨) મુકેશ ઉર્ફે મુકુંદી S/O ગણેશભાઈ બંધનભાઈ ખટીક (મારવાડી) ઉ.વ.૩૭ રહે.૧૪/૪૩૦, મધુમાલતી ચાર માળીયાં, કઠવાડા જી.આઈ.ડી.સી., નિકોલ, અમદાવાદ શહેર (૩) સંજય ઉર્ફે પાનકીંગ S/O ગંગારામ રામનારાયણ કુર્મી (પટેલ) ઉ.વ.૩૨ રહે.અનિલ વકીલની ચાલી, પ્રેમનગર, મેમ્કો, શહેરકોટડા, અમદાવાદ શહેર મુ.ગામ બંસપુર, તા.જિ.રાયબરેલી, યુ.પી. નાઓને પકડી પાડી તેઓ પાસેથી ચોરી કરેલ અલગ-અલગ કંપનીના ત્રણ મોબાઈલ ફોન કિં.રૂ.૧૫,૦૦૦/-, ગેસનો બાટલો કિં.રૂ.૧૦૦૦/- તથા ઓટોરિક્ષા કિં.રૂ.૧,૦૦,૦૦૦/- ની મત્તાની મળી કુલ કિં.રૂ.૧,૧૬,૦૦૦/- ની મત્તાનો મુદ્દામાલ રિકવર કરેલ છે.

પકડાયેલ આરોપીઓની પુછપરછ તપાસ દરમ્યાન નીચે મુજબના ગુનાઓનો ભેદ ઉકેલાયેલ છે.
(૧) કણભા પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૪૯/૨૦૧૮ ઈ.પી.કો. કલમ ૩૭૯
(૨) પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૨૪૦/૨૦૧૭ ઈ.પી.કો. કલમ ૩૭૯

આરોપીઓનો ગુનાહિત પુર્વ ઇતિહાસ

પકડાયેલ આરોપી મુકેશ ઉર્ફે મુકુંદી પોતાના સગરિતો સાથે છેલ્લા આઠ-નવ વર્ષથી આવા પ્રકારની ચોરીઓ કરે છે. તે અગાઉ રામોલ, ઓઢવ, માધુપુરા, કાલુપુર, શાહીબાગ, નરોડા, શહેરકોટડા, કાઈમબ્રાન્ય વિગેરે પોલીસ સ્ટેશનોમાં ચોરી તથા લુંટના ગુનાઓમાં પકડાયેલ છે અને ત્રણ વખત પાસા હેઠળ સુરત તથા પોરબંદર જેલમાં પણ જઈ આવેલ છે.

નાયબ પોલીસ કમિશનર,
કંટ્રોલરૂમ, અ'વાદ શહેર.
પોલીસ કમિશનર વતી.